

Enrollment No: _____

Exam Seat No: _____

C.U. SHAH UNIVERSITY

Summer Examination-2018

Subject Name: Water Resource Management

Subject Code: 2TE05WRM1

Branch: Diploma (Civil)

Semester: 5

Date: 27/03/2018

Time: 10:30 To 01:30

Marks: 70

Instructions:

- (1) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
- (2) Instructions written on main answer book are strictly to be obeyed.
- (3) Draw neat diagrams and figures (if necessary) at right places.
- (4) Assume suitable data if needed.

Q-1	Attempt the following questions:	(14)
a)	The standard height of a standard rain gauge, is a) 10 cm b) 20 cm c) 30 cm d) 50 cm	1
b)	Runoff factor $k = ?$ a) R/P b) P/R c) $1/P$ d) $1/R$	1
c)	In India the recording type rain gauge generally used, is a) weighting type b) tipping type c) recording type d) none of these	1
d)	Choose the correct pair. a) $R = 0.85P - 30.5$ b) $R = 0.85P - 30.5P$ c) $R = 0.85 - 30.5$ d) $R = 0.85P - 30.5P$	1
e)	The depth of an open wells may generally range from m. a) 2 to 20 m b) 3 to 30 m c) 5 to 15 m d) 4 to 28 m	1
f)	A unit hydrograph is a hydrograph representing a) 1 cm runoff b) 1 m runoff c) 100 cm runoff d) 100 m runoff	1
g)	Minimum one rain gauge is required for each _____ area. a) 1000 km^2 b) 2000 km^2 c) 520 km^2 d) 8000 km^2	1
h)	Lysimeter is used to measure _____. a) evapotranspiration b) infiltration c) evaporation d) transpiration	1
i)	Pan coefficient = lake evaporation _____ pan evaporation. a) multiply b) divide c) subtractions d) addition	1
j)	A unit hydrograph is a hydrograph of a rain storm of a specified duration resulting from a runoff of a) 15 mm b) 20 mm c) 25 mm d) 30 mm	1
k)	The rainfall cycle period in India is taken as a) 15 years b) 20 years c) 30 years d) 35 years	1
l)	Maximum evapotranspiration is recorded at _____. a) Mumbai b) Bhopal c) Rajkot d) Surendranagar	1
m)	Pan coefficient of India is ____? a) 0.50 b) 0.70 c) 0.80 d) 0.90	1
n)	Isohyets are the imaginary lines joining the points of equal a) pressure b) height c) humidity d) none of the above	1

Attempt any four questions from Q-2 to Q-8

Q-2	Attempt all questions	(14)
a)	Enlist factors affecting evaporation and explain.	7



	b) Draw sketch and compute the depth of interface.	7
Q-3	Attempt all questions	(14)
a)	Explain the factors affecting the flow of runoff.	7
b)	Discuss the modification of pumping.	7
Q-4	Attempt all questions	(14)
a)	Write the uses and limitations for unit hydrograph.	7
b)	Write the uses of ground water and advantages of ground water	7
Q-5	Attempt all questions	(14)
a)	Write causes and ill effects of salinity.	7
b)	Write advantages and disadvantages of sprinkler irrigation.	7
Q-6	Attempt all questions	(14)
a)	Give comparison for surface drain and sub surface drain.	7
b)	What is need of water resource management? Explain	7
Q-7	Attempt all questions	(14)
a)	Draw component of sprinkler irrigation system. Explain	7
b)	Describe advantages and disadvantages of drip irrigation.	7
Q-8	Attempt all questions	(14)
a)	Write importance and zone of ground water.	7
b)	Define hydrology and draw neat sketch of hydrological cycle.	7

Q-1	Attempt the following questions:	(14)
a)	સ્ટાન્ડ રેનગેજ ની સ્ટાન્ડ ઉચાઈ _____ હોય છે.	1
	a) 10 cm b) 20 cm c) 30 cm d) 50 cm	
b)	રન એફ ફેક્ટર $k = ?$	1
	a) R/P b) P/R c) $1/P$ d) $1/R$	
c)	ભારત માં રેકોર્ડિંગ ટાઇપ રેનગેજ _____ પુકાર નો વપરાય છે.	1
	a) weighting type b) tipping type c) recording type d) none of these	
d)	સાચી જોડી પસંદ કરો.	1
	a) $R = 0.85P - 30.5$ b) $R = 0.85P - 30.5P$ c) $R = 0.85 - 30.5$ d) $R = 0.85P - 30.5P$	
e)	મુલા કુવા ની ટ્રાઇએટ આશરે _____ હોય.	1
	a) 2 to 20 m b) 3 to 30 m c) 5 to 15 m d) 4 to 28 m	
f)	_____ ના હાયડ્રોગ્રાફ ને એકમ હાયડ્રોગ્રાફ કહેયાય.	1
	a) 1 cm runoff b) 1 m runoff c) 100 cm runoff d) 100 m runoff	
g)	_____ ના વિસ્તાર માટે એક રેન ગેજ ની જરૂર પડે.	1
	a) 1000 km^2 b) 2000 km^2 c) 520 km^2 d) 8000 km^2	
h)	Lysimeter _____ માપવા માટે વપરાય છે.	1
	a) evapotranspiration b) infiltration c) evaporation d) transpiration	
i)	પાન કોએફિસિએન્ટ = લેક વસ્પીભાવન _____ પાન વસ્પીભાવન.	1
	a) multiply b) divide c) subtractions d) addition	



j)	એકમ હાયડ્રોગ્રાફ એ ફિક્સ સમય ના વરસાદ ના _____ રનઓફ નો 1 હાયડ્રોગ્રાફ છે.
k)	a) 15 mm b) 20 mm c) 25 mm d) 30 mm ભારત માં રેનફોલ સાયકલ _____ ની લેવાય. 1
l)	a) 15 years b) 20 years c) 30 years d) 35 years સૌથી વધુ છવોપોટાન્સપીરેસન _____ માં નોધાયેલ છે. 1
m)	a) Mumbai b) Bhopal c) Rajkot d) Surendranagar ભારત નું પાન કોએઝીસીએન્ડ _____ ? 1
n)	a) 0.50 b) 0.70 c) 0.80 d) 0.90 આઈસોહાઇટ એ _____ ને જોડતી કાલ્પનિક રેખા છે. 1
	a) pressure b) height c) humidity d) none of the above
Q-2 થી Q-8 માંથી કોઈ પણ ચાર સવાલો ના જવાબ આપો.	
Q-2	બધાજ સવાલો ના જવાબ લખો. (14)
a)	વસ્પીભવન ને અસર કરતા પરિબળો લખો અને સમજાવો. 7
b)	ડેઢ્ય ઓફ ઇન્ટરફેસ દોરો અને સમજાવો. 7
Q-3	બધાજ સવાલો ના જવાબ લખો. (14)
a)	રનઓફ ના ફ્લો ને અસર કરતા પરિબળો લખો અને સમજાવો. 7
b)	પ્રમ્પિંગ નું મોડીફિકેસન ની ચર્ચા કરો. 7
Q-4	બધાજ સવાલો ના જવાબ લખો. (14)
a)	એકમ હાઇડ્રોગ્રાફ ના ઉપયોગો અને કમિયો ની ચર્ચા કરો. 7
b)	ગ્રાઉન્ડ વાટર ના ઉપયોગો અને ફાયદાઓ લખો. 7
Q-5	બધાજ સવાલો ના જવાબ લખો. (14)
a)	સાલીનિતી ના કારણો અને અસરો ની ચર્ચા કરો. 7
b)	કુવારા સિચાઈ પદ્ધતી ના ફાયદા અને નુકસાન લખો. 7
Q-6	બધાજ સવાલો ના જવાબ લખો. (14)
a)	સરફેસ ડ્રેઇન અને સબ સરફેસ ડ્રેઇન ની સખામણી કરો. 7
b)	પાણી ના સ્થોતો નું મેનેજમેન્ટ કરવાની જરૂર શું છે. સમજાવો. 7
Q-7	બધાજ સવાલો ના જવાબ લખો. (14)
a)	કુવારા સિચાઈ પદ્ધતી માં વપરાતા સાધનો દોરો અને સજાવો. 7
b)	ટપક સિચાઈ પદ્ધતી ના ફાયદા અને નુકસાન લખો. 7
Q-8	બધાજ સવાલો ના જવાબ લખો. (14)



- | | | |
|----|--|---|
| a) | ગ્રાઉન્ડ વાટર ના જોન નું મહત્વ લખો. | 7 |
| b) | હાઇડ્રોલોજી ની વ્યાખ્યા આપો અને આકૃતિ સાથે સમજાવો. | 7 |

